

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૫/૫/૨૦૧૭ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૦૯૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૬ કેસ કરી ૨૯ વ્યક્તિઓને ઝડપી, ૧૨૬ લીટર દેશી દારૂ, ૧૦૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૨ બીયરટીન અને ૦૧ કાર કબજે કરી હતી.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૯૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સીઆર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૨૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડી :-

સમાચાર યાદી નં.૧૦૯૩/૧૭

નિકોલ : મીનાબેન પ્રેમભાઈ રાજભર (રહે,ચોથો માળ રોયલ ફ્લોરા, નિકોલ) એ તા.૨૪/૫/૧૭ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૫/૧૭ ના કલાક ૧૦/૩૦ થી બપોરનાં ૪/૦૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરે આરોપી (૧) મૌલીક ઉર્ફે જુગો પટેલ (રહે,ત્રણ માળીયા પેટ્રોલપંપની બાજુમા વસ્ત્રાલ) અને (૨) હેમલ મયંકભાઈ પટેલ (રહે,પારુલ ટેનામેંટ કેડીલા કેનાલની પાસે ઘોડાસર) ભેગામળી મીનાબેનને ઉછીના પૈસા આપવાનો વિશ્વાસ અપાવી, "ઉછીના પૈસાની સિક્યુરીટી માટે તમારે દાગીના આપવા પડશે" તેવું જણાવી, મીનાબેન પાસેથી સોનાની લક્કી કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- તથા સોનાની બુટ્ટી કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- તથા ઇંટેક્સ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦૦૦/- ની મતા મેળવી લઈ, મીનાબેન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.જી.ખાંટ નાઓ ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૦૯૪/૧૭

સેટેલાઈટ : કૈલાશબેન તે જીતેન્દ્રભાઈ ની વિધવા પત્ની જાતે:- સેલત (ઉ.વ.૬૬)(રહે,નિહારીકા બંગલોઝ હીમતલાલ પાર્કની સામે આઝાદ સોસાયટી સેટેલાઈટ) તા.૨૪/૫/૧૭ નાં કલાક ૭/૧૫ વાગ્યાનાં સુમારે નિહારીકા બંગલોઝની અંદરનાં રોડ ઉપર હાજર હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા પુરૂષ (૨૦ થી ૨૨ વર્ષના આશરાના) કૈલાશબેનનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેંચી તોડી લઈ ગયા હતા. આ ગુનાની ફરીયાદ કૈલાશબેન સેલતે સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.જે.કે.વાઘેલા ચલાવે છે.

ચાંદખેડા : હંસાબેન W/O બિપીનચંદ્ર પરમાર (ઉ.વ.૫૫) (રહે,સંસ્કાર આર્કેડ, માનસરોવર રોડ ચાંદખેડા) તા.૨૪/૫/૧૭ નાં કલાક ૧૧/૩૦ વાગ્યાનાં સુમારે ચાંદખેડા સંસ્કાર આર્કેડ સામે, સરલ પરીવેશ ની બાજુમાં આવેલ રોડ ઉપરથી ચાલતાં પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા પુરૂષ (૨૦ થી ૨૨ વર્ષના આશરાના) હંસાબેનનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેંચી તોડી લઈ ગયા હતા. આ ગુનાની ફરીયાદ હંસાબેન પરમારે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.આ ગુનાની તપાસ પોસ.ઈ.એમ.એમ.વાઢેર ચલાવે છે

ચોરી :-

સમાચાર યાદી નં.૧૦૯૫/૧૭

કૃષ્ણનગર : મગનભાઈ લક્ષ્મણભાઈ પટેલ (રહે,ખોડીયારનગર સોસાયટી, મોટા વરાછા, સુરત) એ તા.૨૪/૫/૧૭ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૦૫/૧૭ ના કલાક ૧૨/૦૦ થી ૧૨/૧૫ વાગ્યા દરમ્યાન બજરંગદાસ બાપાના આશ્રમ આગળ રોડ ઉપરથી પોતે રીક્ષામાં બેસી જતા હતા દરમ્યાન રીક્ષામાં બેસેલ પેસેન્જરોની ભીડમાંથી બે છોકરાઓ (૨૦ થી ૨૨ વર્ષ ના આશરાના) મગનભાઈની નજર ચુકવી તેમના પેન્ટમાં જમણી બાજુ કાપો મુકી પેન્ટના ખિસ્સામાં મુકેલ રૂપિયા ૩૦,૫૦૦/- કાઢી લઈ ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પોસ.ઈ.શ્રી ડી.વી.ખરાડી ચલાવે છે.

રામોલ : શર્માબેન વા/ઓ જયેશભાઈ પટેલ (ઉ.વ.૪૫)(રહે,મંગલમ ટેનામેંટ આવકાર હોલની બાજુમાં ઘોડાસર) એ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૫/૧૭ બપોરના ૩/૦૦ થી ૩/૧૫ વાગ્યા દરમ્યાન સોનીની ચાલ થી સી.ટી.એમ. ચાર રસ્તા સુધીની ઓટોરીક્ષાની મુસાફરી દરમ્યાન રીક્ષામાં પાછળની સાઈડ બેઠેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ભેગામળી શર્માબેનની નજર ચુકવી તેમની બેગમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૪,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી જુવાનસિંહ થાવરાજી ચલાવે છે.

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૧૦૯૬/૧૭

સાબરમતી : અમશુભાઈ નાગજીભાઈ આસલ (ઉ.વ.૪૫)(રહે. ગાંધીવાસ-૨, સાબરમતી)એ તા.૨૩/૫/૧૭ બપોરના ૧૨/૦૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઉઘઈ મારવાની દવા પી લીધી હતી. સારવાર અર્થે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૪/૫/૧૭ બપોરનાં ૩/૪૫ વાગે તેમનું મૃત્યુનિપજ્યુ હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી રસિકભાઈ વિઠ્ઠલભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.